



SWAMINARAYAN DHAM INTERNATIONAL SCHOOL BREAKFAST MENU

First Week	Breakfast	Second Week	Breakfast	Third Week	Breakfast	Fourth Week	Breakfast
Monday	Bataka poha, Masala Milk	Monday	Dahivada, Curd Tikhi Chatni	Monday	Mandhu Vada, Sambhar, Mix Bhel-Chatni	Monday	Dal-Pakvan
Tuesday	Idli, Sambhar	Tuesday	Puri- Shak	Tuesday	Thepla, Athanu, Masala Milk, Dhokla , Green Chatni	Tuesday	Utappam Sambhar Puri-Bataka nu Shak
Wednesday	Ragda pattice, Namkeen, chatni / Khaman-Kadhi	Wednesday	Shahi Khichadi, Masala Curd, (Namkeen)	Wednesday	Sev-Usal, Chatni, Chavanu, Papdi-Kadhi-Marcha	Wednesday	Fangavela Mix Kathor Chavanu, Masala Milk
Thursday	Upma, Curd, Sing Bhajiya	Thursday	Dhokla, Green Chatni	Thursday	Sahi-Khichadi Masala Curd (Namkeen)	Thursday	Bataka Poha Masala Milk, Masala Puri, Marcha, Masala Milk
Friday	Mag - Puir-Marcha	Friday	Khaman-Kadhi Papdi - Marcha	Friday	Chole Chana-Puri	Friday	Idli - Sambhar
Saturday	Delhi Chat/ Red and / Green Chatni	Saturday	Kadak Masala Puri, Masala Milk	Saturday	Sev Khamni-Kadhi Tikhi Chatni (Bhungla-Bataka)	Saturday	Mix Bhajiya-Chatni Muthiya - Masala Milk
Ekadashi 1	Buff vada, Chatni, Raj. Puri, Batata nu Shak, Farari bataka ni Khichadi.	Ekadashi 2	Sabudana Khichdi, Curd, Raj. Puri, Wafers-Kheer, (Batter Milk)				



SWAMINARAYAN DHAM INTERNATIONAL SCHOOL BREAKFAST MENU

First Week	Breakfast	Second Week	Breakfast	Third Week	Breakfast	Fourth Week	Breakfast
Monday	ભટાકા પોઆ મસાલા દુધ	Monday	દહીંવડા-દહીં તીખી ચટણી	Monday	મેંદુવડાં, સંભાર (મીક્ષ ભેળ, ચટણી)	Monday	દાળ-પકવાન
Tuesday	ઈડલી-સંભાર	Tuesday	પુરી- શાક	Tuesday	થેપલા, અથાણાં, મ.દૂધ (ટોકળા, ગ્રીન-ચટણી)	Tuesday	ઉત્તપમ-સંભાર (પુરી-ભટાકાનું શાક)
Wednesday	રગડા-પેટીસ, ચવાણુ-ચટણી ખમણ-કટી	Wednesday	શાહી-ખીચડી મસાલા દહીં(નમકીન)	Wednesday	સેવ-ઉસળ, ચટણી, ચવાણું (પાપડી, કટી, મરચાં)	Wednesday	ફણગાવેલા મીક્ષ કઠોળ, ચવાણું, મસાલા દુધ
Thursday	ઉપમા-દહીં, સીંગ ભજુયા	Thursday	ટોકળા, ગ્રીન ચટણી	Thursday	શાહી ખીચડી, મસાલા દહીં (નમકીન)	Thursday	ભટાકા પોઆ, મસાલા દુધ (મસાલા પુરી, મરચાં, દુધ)
Friday	મગ-પૂરી-મરચાં	Friday	ખમણ-કટી પાપડી-મરચાં	Friday	છોલે ચણા, પુરી	Friday	ઈડલી-સંભાર
Saturday	દિલ્લી ચાટ રેડ અને ગ્રીન ચટણી	Saturday	કડક મસાલા પુરી દૂધ	Saturday	સેવખમણી, કટી, તીખી, ચટણી(ભૂંગળા-ભટાકા)	Saturday	મીક્ષ ભજુયા ચટણી (મુઠીયા-દૂધ)
Ekadashi 1	બફવડા, ચટણી, રાજ. પુરી, ભટાકાનું શાક, ફરાળી ભટાકાની ખીચડી	Ekadashi 2	સાબુદાણાની ખીચડી, દહીં. રાજ. પુરી, ભાજુ, વેફર્સ-ખીર(છાશ)				